

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટને 2019 માટે મજબૂત ક્રેડિટ રેટિંગ જાળવી રાખ્યું છે

સિટીની મજબૂત વિકાસ વ્યવસ્થા અને અસાધારણ પ્રવાહિતાની સ્થિતિ તેને ટ્રિપલ "A" ક્રેડિટ રેટિંગ અને સ્થિર ભાવિ પરિસ્થિતિ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.

બ્રેમ્પટન, ઓન્ટારિયો (10 ઓક્ટોબર 2019) – એસ એન્ડ પી ગ્લોબલ (S&P Global) દ્વારા સીટી ઓફ બ્રેમ્પટનનાં 2019 માટેનાં ટ્રિપલ "A" રેટિંગનું અનુમોદન કર્યું છે કે કોઈ પણ નગરપાલિકા સ્થિર ભાવિ માટે મેળવી શકે એવું આ ઉચ્ચતમ દરંકન ગણી શકાય. S&P અનુસાર આ રેટિંગ સિટીની નક્કર વિકાસ વ્યવસ્થાનું પ્રતિબિંબ છે.

મુખ્ય મુદ્દાઓ

એસ એન્ડ પી ગ્લોબલ (S&P Global) જણાવે છે કે સિટીના મજબૂત રેટિંગ માટે અનેક પરિબલોનું યોગદાન છે. અહેવાલના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે:

"બ્રેમ્પટન અસાધારણ પ્રવાહિતાની સ્થિતિ જાળવી રાખે છે અને સાથે જ તેમની ઋણ સેવા આવરણનું સ્તર અન્ય સાથીઓની તુલનામાં વધુ મજબૂત છે."

"સિટીએ પોતાના વિકાસની જરૂરિયાતોને પહોંચી વળવા અને પોતાની વિકાસ વ્યવસ્થા સમજદારીપૂર્વક નિભાવવા માટે આવશ્યક પગલાં લેવા ચાલુ રાખ્યા છે."

"સિટી પ્રસંગોચિત માહિતી સરળતાથી અને પારદર્શક રીતે પૂરી પાડે છે અને પ્રચલન અને કેપિટલ અંદાજપત્રો વિગતવાર તૈયાર કરે છે."

લિંક:

[સીટી ઓફ બ્રેમ્પટન 'AAA' રેટિંગનું અનુમોદન; ભાવિ સ્થિર રહેશે](#)

અવતરણો

"સંતોષજનક વિકાસ વ્યવસ્થા સાથે સુશાસન અને સરકારી ઉત્કૃષ્ટતાની કટિબદ્ધતા ધરાવતા શહેર તરીકે બ્રેમ્પટન દ્વારા હજુ એક વર્ષ સુધી મજબૂત ક્રેડિટ રેટિંગને જાળવી રાખ્યું છે. સિટીની સ્થિતિસ્થાપક નાણાકીય સ્થિતિ એ ઘણા પરિબલો પૈકી એક છે જે બ્રેમ્પટનને રોકાણ માટે આકર્ષક બનાવે છે. આ રેટિંગ અમારા ફોરિન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ્સને સિટીમાં લાવવાનાં પ્રયાસોને સમર્થન આપે છે."

- મેયર પેટ્રિક બ્રાઉન (*Mayor Patrick Brown*)

"બ્રેમ્પટનની નક્કર નાણાકીય સ્થિતિ આપણાં સમાજ અને નિવેશકારો માટે વિશ્વાસનો મત છે. કેનેડાના સૌથી ઝડપથી વિકાસ પામતા શહેરો પૈકી એક તરીકે જે ઈનોવેશન કોરિડોરમાં સ્થિત છે, અમારી જવાબદારી બને છે કે રહેવાસીઓ અને વ્યવસાયો સહિત અમારા વૈવિધ્યપૂર્ણ સમુદાયની જરૂરિયાતોને અમે સમતોલ રાખીએ. અમે અમારા અભિગમમાં નાણાકીય રીતે જવાબદાર રહેવા પ્રતિબદ્ધ છીએ."

- રિજનલ કાઉન્સિલર પૉલ વિસેન્ટ, અંદાજપત્ર સમિતિના ઉપપ્રમુખ (*Regional Councillor Paul Vicente, ViceChair of Budget Committee*)

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તમાં 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા ઢુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca

